

**FORM G**  
**INVITATION FOR EXPRESSION OF INTEREST**  
(Under Regulation 36A (1) of the Insolvency and Bankruptcy (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016)

RELEVANT PARTICULARS	
1. Name of the corporate debtor	National Steel and Agro Industries Limited.
2. Date of incorporation of corporate debtor	January 09, 1985
3. Authority under which corporate debtor is incorporated / registered	ROC-Mumbai
4. Corporate identity number / limited liability identification number of corporate debtor	L27100MH1985PLC140379
5. Address of the registered office and principal office (if any) of corporate debtor	621, Tulsiani Chambers, Nariman Point, Mumbai MH 400021 IN
6. Insolvency commencement date of the corporate debtor	April 11, 2022
7. Date of invitation of expression of interest	June 17, 2022
8. Eligibility for resolution applicants under section 25(2)(h) of the Code is available at:	By email request to <a href="mailto:corp.nsai@decoderesolvency.com">corp.nsai@decoderesolvency.com</a> Or visit: <a href="http://nsai.decoderesolvency.com">nsai.decoderesolvency.com</a>
9. Norms of eligibility applicable under section 25A are available at:	July 4, 2022
10. Last date for receipt of expression of interest	July 11, 2022
11. Date of issue of provisional list of prospective resolution applicants	July 11, 2022
12. Last date for submission of objections to provisional list	July 16, 2022
13. Date of issue of final list of prospective resolution applicants	July 20, 2022
14. Date of issue of information memorandum, evaluation matrix and request for resolution plans to prospective resolution applicants	July 16, 2022
15. Manner of obtaining request for resolution plan, evaluation matrix, information memorandum and further information	Potential Resolution Applicants receive email from: <a href="mailto:corp.nsai@decoderesolvency.com">corp.nsai@decoderesolvency.com</a>
16. Last date for submission of resolution plans	August 17, 2022
17. Manner of submitting resolution plans to resolution professional	Submit All Documents in 2 parts on or before the last date Part 1: Sealed Envelope Addressed to: Dushyant C Dave, 1101 Dalami Towers, Nariman Point, Mumbai-400021, India Part 2: Email all documents in a password protected file to: <a href="mailto:corp.nsai@decoderesolvency.com">corp.nsai@decoderesolvency.com</a> August 26, 2022
18. Estimated date for submission of resolution plan to the Adjudicating Authority for approval	
19. Name and registration number of the resolution professional	Dushyant C Dave IBBI/IPA-003/IP-N00061/2017-18/10502
20. Name, Address and e-mail of the resolution professional, as registered with the Board	1101 Dalami Towers, Nariman Point, Mumbai - 400021 INDIA. Email id: <a href="mailto:dushyant.dave@decoderesolvency.com">dushyant.dave@decoderesolvency.com</a>
21. Address and email to be used for correspondence with the resolution professional	Dushyant C Dave, 1101, Floor-11, Plot-211, Dalami Tower, Free Press Journal Marg, Nariman Point, Mumbai, Maharashtra-400021 Email id: <a href="mailto:corp.nsai@decoderesolvency.com">corp.nsai@decoderesolvency.com</a>
22. Further details are available at or with	By email request to <a href="mailto:corp.nsai@decoderesolvency.com">corp.nsai@decoderesolvency.com</a>
23. Date of publication of Form G	June 17, 2022

**RP Dushyant C Dave**  
IBBI Regn. No.: IBBI/IPA-003/IP-N00061/2017-18/10502  
IP's registered email: [dushyant.dave@decoderesolvency.com](mailto:dushyant.dave@decoderesolvency.com)  
Communication ID: [corp.nsai@decoderesolvency.com](mailto:corp.nsai@decoderesolvency.com)

Date: June 17, 2022  
Place: Mumbai

**Whirlpool**  
**WHIRLPOOL OF INDIA LIMITED**  
(CIN: L29191PN1960PLC020063)  
Regd. Office: Plot No. A-4, MIDC, Ranjangaon, Taluka-Shirur, Dist. Pune-412220, Maharashtra  
Tel No.: 02138-660100; Fax No.: 02138-232376  
E-mail: [investor\\_contact@whirlpool.com](mailto:investor_contact@whirlpool.com)  
Website: [www.whirlpoolindia.com](http://www.whirlpoolindia.com)

**NOTICE TO THE SHAREHOLDERS REGARDING 61<sup>ST</sup> ANNUAL GENERAL MEETING OF THE COMPANY**

- NOTICE is hereby given that the Sixty First Annual General Meeting (AGM) of Whirlpool of India Limited ("the Company") will be held on Friday, 15<sup>th</sup> July, 2022 at 11:00 AM (IST) through Video Conference/Other Audio Visual Means ("VC/OAVM") in compliance with all the applicable provisions of Companies Act, 2013 ("Act") and the Rules made thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") read with General Circular No. 14/2020 dated April 08, 2020, No. 17/2020 dated April 13, 2020, No. 20/2020 dated May 05, 2020 and subsequent circulars issued in this regards, latest being General Circular No. 02/2022 dated May 05, 2022 issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars"), Circular No. SEBI/HO/CFD/CMD2/ CIRP/P/2022/62 dated May 13, 2022 issued by the Securities and Exchange Board of India ("SEBI Circular") and other applicable circulars issued in this regard, to transact the business that will be set forth in the Notice of AGM.
- The Notice of the AGM along with the Annual Report for the Financial Year (FY) 2021-22 will only be sent by electronic mode to those members whose e-mail addresses are registered with the Company/Depository Participant(s) ("DPs") in compliance with the aforesaid MCA Circulars and SEBI Circular. Members may note that the Notice of the AGM and Annual Report will also be available on the Company's website at [www.whirlpoolindia.com](http://www.whirlpoolindia.com), website of Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) respectively and also on the website of NSDL at [www.evoting.nsdl.com](http://www.evoting.nsdl.com). The copies of the Notice of the AGM along with Integrated Annual Report for the FY 2021-22 shall be sent to those Members who request for the same.

**3. Manner of registering/updating email address:**

<b>Members holding shares in physical form</b>	Members holding shares in physical mode and who have not updated their email address with the Company are requested to update their email addresses by writing to <a href="mailto:RTA@delhi@linkintime.co.in">RTA@delhi@linkintime.co.in</a> or <a href="mailto:shikha.karakoti@linkintime.co.in">shikha.karakoti@linkintime.co.in</a> or <a href="mailto:sunil.mishra@linkintime.co.in">sunil.mishra@linkintime.co.in</a> along with the copy of the signed request letter in ISR-1 mentioning the name, folio number and address of the member, self-attested copy of the PAN card, and self-attested copy of any document (e.g.: Driving License, Election Identity Card, Passport) in support of the address of the Member.
<b>Members holding shares in demat form</b>	Please contact your DP's and register or update your email address with the respective DP's.

**4. Manner of casting vote through e-voting:**

- The Company will be providing remote e-voting ("remote e-voting") facility to all its members to cast their vote on all the resolutions set out in the Notice of the AGM. Additionally, the Company will also provide the facility of voting through e-voting system during the AGM ("e-voting"). Detailed procedure for remote e-voting/e-voting will be provided in the Notice of the AGM.
- The login credentials for casting the votes through e-voting shall be made available through the various modes provided in the Notice as well as through email after successful registration of the email addresses. The details will also be made available on the website of the Company.

**5. Book Closure and Final Dividend:**

Pursuant to Section 91 of the Act and Regulation 42 of SEBI Listing Regulations, the Register of Members and Share Transfer books will remain closed from Thursday, 30<sup>th</sup> June, 2022 to Wednesday, 06<sup>th</sup> July, 2022 (both days inclusive) for ascertaining the list of Members who will be entitled to receive dividend of ₹ 5 per share for the financial year ended March 31, 2022, subject to approval of shareholders at the ensuing AGM of the Company. The dividend will be payable online to those members whose bank details are updated and via dividend warrants/demand drafts/cheques to the members whose bank details are not registered with the Company.

**6. Manner of registering KYC including bank details for receiving Dividend:**

- For Members holding shares in physical mode, SEBI vide its Circular dated 3<sup>rd</sup> November, 2021, has mandated registration of PAN, mobile number, email, address with PIN code, nomination, specimen signature and bank details (collectively referred to as "KYC") with Company/Registrar and Share Transfer Agent (RTA). Members holding shares in physical form are, therefore, requested to update their KYC with RTA at Link Intime India Private Limited, Noble Heights, 1<sup>st</sup> Floor, Plot NH-2, C-1 Block LSC, Near Savitri Market, Janakpuri, New Delhi-110058 by sending a duly filled Form ISR-1 and other relevant forms available on the website of the Company at [www.whirlpoolindia.com](http://www.whirlpoolindia.com) or RTA at [www.linkintime.co.in](http://www.linkintime.co.in).

- Members holding shares in dematerialised mode are requested to update their complete bank details with their DP's to avoid delay in receiving the dividend.

**7. Tax on Dividend**

- Members may note that the Income Tax Act, 1961 (Act), as amended by the Finance Act, 2020, mandates that dividends paid or distributed by a Company after 1<sup>st</sup> April, 2020 shall be taxable in the hands of the Members. The Company shall therefore be required to deduct Tax at Source (TDS) at the time of making payment of the final dividend. In order to enable us to determine the appropriate TDS rate, as applicable, Members are requested to submit the documents in accordance with the provisions of the Act.

- For Resident Members, tax shall be deducted at source under Section 194 of the Act at 10% on the amount of Dividend declared and paid by the Company during FY 2022-23, subject to submission of PAN by the Member. If PAN is not submitted, TDS would be deducted @ 20% as per Section 206AA of the Act.

- In cases where the Member submits Form 15G (applicable to any person other than a Company or a Firm)/Form 15H (applicable to an individual above the age of 60 years), provided that the eligibility conditions are being met, no tax at source shall be deducted.

- Apart from the above, since the TDS/Withholding rates are different for resident and non-resident Members, if there is a change in your residential status, as per the provisions of the Act, you are requested to get your residential status updated in your demat account or the physical folio, as applicable, before the Record Date.

- Tax Exemption Forms are available at the website of RTA [www.linkintime.co.in](http://www.linkintime.co.in). This notice is being issued for the information and benefit of all the Members of the Company in compliance with the applicable circulars of the MCA and SEBI.

For Whirlpool of India Limited  
Roopal Singh  
Company Secretary

Place: Gurugram  
Date: 16 June, 2022

For Advertising in  
**TENDER PAGES**  
Contact  
**JITENDRA PATIL**  
Mobile No.: 9029012015  
Landline No.: 67440215

U.P. CO-OPERATIVE SUGAR FACTORIES FEDERATION LTD.  
B-4, Rana Pratap Marg, Lucknow  
Ph. No. 4322 20013, 20013 Fax: 432794  
e-mail: [upsugarfed@yahoo.co.in](mailto:upsugarfed@yahoo.co.in) Website: [www.upsugarfed.org](http://www.upsugarfed.org)

फोन संख्या : ०५-४३२७९०१०/१९६०/ दिनांक: १६.०६.२०२२

**Tender Notice**  
Online e-tenders are invited from Manufacturers/ Authorised dealer (as per details given in tender documents) for supply of Stainless steel tubes to our various Cooperative Sugar Factories of U.P. The e-tender documents with detailed specifications terms and conditions etc. can be downloaded from e-tender portal <http://tender.up.nic.in> and federation website [www.upsugarfed.org](http://www.upsugarfed.org) time to time. Old bidder should also submit the tender fee Rs. 2,360/-.

The Managing Director Federation reserves the right to cancel any or all bids/annual e-bidding process without assigning any reason & decision of Federation will be final & binding.

**MANAGING DIRECTOR**

**PUBLIC NOTICE**  
**TO WHOMSOEVER IT MAY CONCERN**  
THIS IS TO INFORM THE GENERAL PUBLIC THAT FOLLOWING SHARE CERTIFICATE(S) OF PIX TRANSMISSIONS LIMITED HAVING ITS REGISTERED OFFICE AT J-7, MIDC, HINGNA ROAD, NAGPUR-490016, REGISTERED IN THE NAME(S) OF THE FOLLOWING SHARE HOLDER(S) HAS/HAVE BEEN LOST BY THEM.

NAME OF HOLDER(S)	FOLIO NO.	CERTIFICATION NO.	DISTINCTIVE NO.	NO OF SHARES
NILAM K MEHTA	N050315	58054	4355301 - 4355400	100
KANTI J MEHTA				

THE PUBLIC ARE HEREBY CAUTIONED AGAINST PURCHASING OR DEALING IN ANY WAY WITH THE ABOVE REFERRED SHARE CERTIFICATE(S). ANY PERSON(S) HAS/HAVE ANY CLAIM IN RESPECT OF THE SAID CERTIFICATE(S) SHOULD LODGE SUCH CLAIM WITH THE COMPANY OR ITS REGISTRAR AND TRANSFER AGENTS Link Intime India Private Limited, C-101, 247 Park, L.B.S. Marg, Vikhroli (West) Mumbai - 400083. WITHIN 15 DAYS OF PUBLICATION OF THIS NOTICE. AFTER WHICH NO CLAIM WILL BE ENTERTAINED AND THE COMPANY MAY PROCEED TO ISSUE DUPLICATE SHARE CERTIFICATE(S).

NAME OF SHARE HOLDER:  
**1. NILAM K MEHTA 2. KANTI J MEHTA**

PLACE: MUMBAI | DATE: 17/06/2022

**FORM A**  
**PUBLIC ANNOUNCEMENT**  
(Regulation 14 of the Insolvency and Bankruptcy Board of India (Voluntary Liquidation Process) Regulations, 2017)

**FOR THE ATTENTION OF THE STAKEHOLDERS OF CPDC GEMINI STAR (INDIA) PRIVATE LIMITED**

RELEVANT PARTICULARS	
1. Name of corporate person	CPDC GEMINI STAR (INDIA) PRIVATE LIMITED
2. Date of incorporation of corporate person	06/01/2019
3. Authority under which corporate person is incorporated / registered	Registrar Of Companies, Mumbai under the Companies Act, 2013
4. Corporate identity number / limited liability identity number of corporate person	U74999MH2019FTC319194
5. Address of the registered office and principal office(fany) of corporate person	Level 7, The Capital, Plot No. C-70, G Block, Bandra Kurla Complex, Bandra Mumbai 400051
6. Liquidation commencement date of corporate person	13th June 2022
7. Name, address, email address, telephone number and the registration number of the liquidator	Mrs. Purnima Shetty, Dkx, Om Woods, Plot No 144, Nr. Dmart, Sector-21, Navi East, New Mumbai 400706 Email: <a href="mailto:pcspurnima@gmail.com">pcspurnima@gmail.com</a> Tel. No. +91-992010095 Regn No. IBBI/IPA-002/IP-N00394/2017-18/11197
8. Last date for submission of claims	13th July 2022

Notice is hereby given that the CPDC GEMINI STAR (INDIA) PRIVATE LIMITED has commenced voluntary liquidation on 13th June 2022. The stakeholders of CPDC GEMINI STAR (INDIA) PRIVATE LIMITED are hereby called upon to submit a proof of their claims, on or before 13th July 2022 to the liquidator at the address mentioned against item 7. The financial creditors shall submit their proof of claims by electronic means only. All other stakeholders may submit the proof of claims in person, by post or by electronic means. Submission of false or misleading proofs of claim shall attract penalties.

Sd/-  
Purnima Shetty  
Liquidator of CPDC Gemini Star (India) Private Limited  
IBBI/IPA-002/IP- N00394/2017-18/11197

Date: 17th June 2022  
Place: Mumbai

**इंडियन बैंक**  
**Indian Bank**  
**ALLAHABAD**  
CUMBALA HILL BRANCH: 56, Jewellers Apartment, Pedder Road, Cumbala Hill, Mumbai - 400026, Tel: 022-23886161, E-mail: [cumbalahill@indianbank.co.in](mailto:cumbalahill@indianbank.co.in)

**POSSESSION NOTICE**

**Under Rule 8(1) of security Interest (Enforcement) Rule 2002**

Whereas, the undersigned being the authorised officer of Indian Bank, Cumbala Hill Branch, 56, Jewellers Apartment, Pedder Road, Cumbala Hill, Mumbai - 400026, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (act No. 54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002 issued a Demand Notice Dated 25.03.2022 calling upon the Borrower, **Mrs. Natasha Dilipsingh Parihar and Mr. Dilipsingh Parihar (Guarantor)** to repay the amount mentioned in the notice ₹ 22,25,343.00 (Rupees Twenty Two Lakhs Twenty Five Thousand Three Hundred Forty Three Only) as on 25.03.2022 within 60 days from the date of receipt of said notice with future interest and incidental charges w.e.f 25.03.2022.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the Public in General that the undersigned has taken **Symbolic Possession** of the Property described here in below in exercise of powers conferred on him/ her under section 13(4) of the said Act read with rule 8 and 9 of the said rule on this 13<sup>th</sup> of June, 2022.

The Borrower in particular and the Public in General is hereby cautioned not to deal with the Property and any dealings with the Property will be subject to the charge of Indian Bank Cumbala Hill Branch, 56 Jewellers Apartment, Pedder Road, Cumbala Hill, Mumbai - 400026, for an amount of ₹ 22,25,343.00 (Rupees Twenty Two Lakhs Twenty Five Thousand Three Hundred Forty Three Only) as on 25.03.2022 with the future interest and incidental charges w.e.f. 25.03.2022.

**DESCRIPTION OF IMMOVABLE PROPERTY:**

Residential House having Survey No./ Gut No. 44 (PT), Plot No. 71/2, Vajradharan Nagri & BM, Petrol Pump, Vangaon- Chinchani Main Road, Village- Vangaon, Dahanu, Thane, Maharashtra - 401102, Boundaries:- East- Open Plot, West- Open Plot, North- Open Plot, South- Vangaon Chinchani Main Road.

Date : 13.06.2022  
Place: Cumbala Hill

Sd/-  
Authorized Officer, Indian Bank

**ALFRED HERBERT (INDIA) LIMITED**  
CIN: L74999WB1919PLC003516  
Regd Office: 13/3, Strand Road, Kolkata 700001  
Email: [kolkata@alfredherbert.com](mailto:kolkata@alfredherbert.com),  
Website: [www.alfredherbert.co.in](http://www.alfredherbert.co.in)

**NOTICE OF 102ND ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION**

Notice is hereby given that One Hundred and Second Annual General Meeting of the Company will be held on **Friday, 12th day of August, 2022 at 10:30 A.M.** through Video Conferencing ("VC")/ Other Audio Visual Means ("OAVM") to transact the business, as set out in the Notice of the AGM.

In view of the continuing COVID-19 Pandemic, the Ministry of Corporate Affairs (MCA) vide its circular dated 5th May, 2022 read together with circulars dated 13th January, 2021, 8th April, 2020, 13th April, 2020 and 5th May, 2020 (collectively referred to as "MCA Circulars"), permitted convening the Annual General Meeting ("AGM") / "Meeting" through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM"), without physical presence of the members at a common venue. Further, the securities and Exchange Board of India vide its circular dated 12th May, 2020 and 15th January, 2021 ("SEBI circulars") has also granted certain relaxations. In accordance with the MCA Circulars, SEBI circulars, provisions of the Companies Act, 2013 ("the Act") and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"), the 102nd AGM of the Company is being held through VC / OAVM.

The Notice of the AGM along with the Annual Report 2021-22 will be sent by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Depositories in accordance with the aforesaid MCA Circular dated 12th May 2020. Members may note that the Notice of the AGM and the Annual Report 2021-22 will be available on the Company's website: [www.alfredherbert.co.in](http://www.alfredherbert.co.in) and website of Stock Exchange i.e. BSE Limited: [www.bseindia.com](http://www.bseindia.com).

The Register of members and Share Transfer books of the Company will remain closed from **Saturday, 6th August, 2022 to Friday, 12th August, 2022 (both days inclusive).**

In accordance with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015, the Company has fixed **Friday, 5th August, 2022 as "cut-off date"** to determine the eligibility of Members to vote by electronic means or vote at the AGM. A person whose name is recorded in the Register of members of the Company or in the Statement of Beneficial Owners maintained by the depositories as on the cut-off date, i.e. **Friday, 5th August, 2022**, only shall be entitled to avail the facility of e-voting or vote at the AGM.

The remote e-voting period commences on **Tuesday, 9th August, 2022 at 10:00 a.m. and ends on Thursday 11th August, 2022 at 5.00 p.m.**

**Manner of registering / updating e-mail addresses:**

- Members holding share(s) in physical mode are requested to register their email address in order to receive notice of the 102nd AGM and Annual Report for the year ended 31st March, 2022 and the login credentials for e-voting by uploading the same at: Link for updation of PAN - <http://mdpl.in/form/pan-update> and link for updation of Email id - <http://mdpl.in/form/email-update>.
- Member(s) holding shares in electronic mode are requested to register/ update their e-mail addresses with their respective Depository Participant(s) for receiving communication from the Company electronically.

**Manner of Casting Vote through e-voting**

- The Company is providing facility of remote e-voting to its Members in respect of all resolutions set out in the Notice convening the 102nd AGM. The facility of casting votes by a member using remote e-voting as well as the e-voting system on the date of the AGM will be provided by CDLS. Members attending the 102nd AGM through VC/OAVM will be counted for the purpose of ascertaining the quorum under Section 103 of the Companies Act, 2013.

- The login credentials for casting the votes through e-voting shall be made available to the members through e-mail after they successfully register their e-mail addresses in the manner provided above.

Members are requested to carefully read the Notice of the AGM and in particular, instructions for joining the AGM, manner of casting vote through remote e-voting or voting at the AGM.

For Alfred Herbert (India) Limited  
Shobhana Sethi  
Chief Financial Officer & Company Secretary

Place: Kolkata  
Date: 16th June, 2022

**@home**  
**NILKAMAL LIMITED**  
CIN : L25209DN1985PLC000162  
Regd. Office: Survey No. 354/2 & 354/3, Near Rakholi Bridge, Silvassa-Kharvel Road, Vasona, Silvassa - 396 230 (Union Territory of Dadra & Nagar Haveli)  
Phone: 0260-2699212 • Fax: 0260-2699023  
Email: [investor@nilkamal.com](mailto:investor@nilkamal.com) • Website: [www.nilkamal.com](http://www.nilkamal.com)

**36<sup>th</sup> ANNUAL GENERAL MEETING (AGM)**

Notice is hereby given that the **36<sup>th</sup> Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Saturday, July 16, 2022 at 11.00 a.m. through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM)**, as per provisions of Companies Act, 2013, Rules framed thereunder and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with the Ministry of Corporate Affairs ("MCA") circular dated April 8, 2020 and April 13, 2020, May 5, 2020, January 13, 2021 and May 5, 2022 (collectively referred to as "MCA Circulars") and Securities and Exchange Board of India Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11, Dated January 15, 2021 (referred to as "SEBI Circular") without the physical presence of the Members at a common venue.

The Annual Report of the Company for the year 2021-2022 including the Financial Statements for the year ended March 31, 2022 ("Annual Report") along with Notice of the AGM will be sent only by email to all those Members, whose email addresses are registered with the Company or with their respective Depository Participants ("Depository") and the Company's Registrar and Transfer Agent, Link Intime India Private Limited, in accordance with the MCA Circulars and the SEBI Circulars.

Members can join and participate in the AGM through VC/ OAVM facility only. The instructions for joining the AGM and the manner of participation in the remote electronic voting or casting vote through the e-voting system during the AGM are provided in the Notice of the AGM. Members participating through the VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. The Annual Report of the Company for the year 2021-2022 along with the Notice of AGM will be available on the website of the Company, i.e. [www.nilkamal.com](http://www.nilkamal.com) and the website of BSE Limited and National Stock Exchange of India Limited, i.e. [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com). Members holding shares in physical mode and who have not updated their e-mail addresses with the Company can obtain Notice of the AGM, Annual Report and/or login details for joining the AGM through VC/OAVM facility including e-voting by sending scanned copy of (a) Copy of the signed request letter mentioning the folio number, name and address of the Member, (b) Self-attested copy of the PAN card, and (c) Self-attested copy of any document (eg.: Aadhar, Driving License, Election Identity Card, Passport) in support of the address of the Member by email to [investor@nilkamal.com](mailto:investor@nilkamal.com). Additionally for obtaining login details member(s) may sent above details through e-mail directly at [evoting@nsdl.co.in](mailto:evoting@nsdl.co.in).

Board of Directors at their Meeting held on Monday, May 23, 2022, recommended Final Dividend at the rate of Rs. 15/- per equity share having nominal value of Rs. 10/-for financial year ended March 31, 2022.

The Final Dividend shall be credited to the eligible Member(s) directly to the respective bank accounts through Electronic Clearing Service (ECS)/ National Automated Clearing House (NACH) etc. In order to receive the dividend without any delay, the Members holding shares in physical form are requested to submit duly signed letter containing folio number, particulars of their bank accounts along with the original cancelled cheque bearing the name of the Member and copy of PAN to M/s Link Intime India Private Limited, C-101, 247 Park, L.B.s. Marg, Vikhroli, West, Mumbai - 400083 to update their bank account details and all the eligible shareholders holding shares in demat mode are requested to update with their respective Depository Participants before Friday, July 8, 2022, their correct Bank Account Number, including 9 Digit MICR Code and 11 digit IFSC Code, E-mail ID and Mobile No(s).

Shareholders are also informed that in terms of provisions of Income Tax Act, 1961, dividend paid and distributed by the Company will be taxable in the hand of shareholders. Communication in this regard shall also be available on the Company website [www.nilkamal.com](http://www.nilkamal.com).

The Company is pleased to provide remote e-voting facility to the Members to cast their votes electronically on all the resolutions set forth in the Notice convening the said Meeting. The facility of e-voting will also be made available at the AGM and Members attending the AGM through VC/OAVM, who have not cast their vote by remote e-voting, will be able to vote at the AGM. The Company has availed the services of NSDL to provide the facility of remote e-voting / e-voting at the AGM.

The remote e-voting period begins on Wednesday, July 13, 2022, (at 9:00 A.M.IST) and ends on Friday, July 15, 2022, (at 5:00 P.M. IST). During this period shareholders of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date Friday, July 8, 2022, may cast their vote electronically. The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. The voting rights of Members shall be in proportion to their shares in the paid-up equity share capital of the Company as on the cut-off date i.e. July 8, 2022.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after sending of the Notice and holding shares as of the cut-off date, may obtain the login ID and password by sending a request at [evoting@nsdl.co.in](mailto:evoting@nsdl.co.in). However, if he/she is already registered with NSDL for remote e-voting then he/she can use his/her existing User ID and password for casting the vote.

The details instructions for joining the AGM through VC/OAVM and casting the vote through remote e-voting / e-voting at the AGM is provided in the Notice of AGM. Members are requested to carefully go through the same. Members, who need assistance before or during the AGM regarding e-voting facility and / or VC/OAVM facility, can send a request at [evoting@nsdl.co.in](mailto:evoting@nsdl.co.in) or use Toll free no.: 1800 1020990/ 1800 224430.

Notice is also given that Register of Members and the Share transfer books of the Company will remain closed from Saturday, July 9, 2022 to Saturday, July 16, 2022 (both days inclusive) for the purpose of Annual General Meeting and dividend.

The Dividend when sanctioned will be payable to those Equity Shareholders, holding shares either in physical form or in dematerialized form on the close of Friday, July 8, 2022.

By order of the Board of Directors  
Priti Dave  
Company Secretary

Place : Mumbai  
Dated : 17-06-2022

**DCB**



## CENTRAL RAILWAY

VARIOUS WORKS

OPEN E-TENDER NOTICE NO.: 15/2022 OF 17.06.2022

For & on behalf of President of India invites open E-Tender through website [www.ireps.gov.in](http://www.ireps.gov.in) from reputed contractors. **Name of Work:** (A) Improvement and renovation of toilet blocks, repairs to officer's chambers in PRS (old annex building), station building and parcel building. (B) Electrification of two multi-storied (G+2) building in lieu of various huts for staff or different departments working in CSMT big yard. **Tender Notice No.:** 15/2022 (BB.L.G.W. CSMT-2022-02). **Approximate Cost of the Work:** ₹ 31,23,456/- **Bid Security:** ₹ 62,500/- **Validity:** 60 Days. **Completion / Maintenance Period:** 06 Months (C). **Instructions:** (1) Tender closing date & time of aforesaid tender: Upto 13.00 hours of 08.07.2022 and will be opened after 13.00 hrs. (2) The prospective tenderers are requested to visit the website [www.ireps.gov.in](http://www.ireps.gov.in) for complete details of tenders & corrigendum, if any. (3) Tenderer may participate in above e-tender electronically through website [www.ireps.gov.in](http://www.ireps.gov.in) only & submission of manual offers against e-tender are not allowed. Manually, if submitted shall neither be opened nor considered. (4) For further enquiry, may contact: Senior Divisional Electrical Engineer (General Service), Annex Bldg., 1st floor, Central Railway, Mumbai CSMT. (5) This tender complies with Public Procurement Policy Order 2017 dated 15.06.2017. **Sr. DEE (G), CSMT**

RailMadad Helpline 139

MAN-211

Before Debts Recovery Tribunal-III, Delhi  
4th Floor, Jeevan Tara Building,  
Parliament Street, New Delhi - 110001

Notice under section 19(4) of the Recovery of Debts Due to Banks and Financial Institutions Act, 1993 read with Rule 12 & 13 of the Debts Recovery Tribunal (Procedure Rules) 1993

In the matter of O.A. No. 225/2021

STATE BANK OF INDIA Applicant

MRS. SUSHMA MALIK Vs

Defendants

To D-1. Mrs Sushma Malik W/o Mr. Pushpendra Malik Sole Proprietor of M/s Malik Generators R/o 17, Dunga Parasoli, District Muzaffarnagar, Uttar Pradesh-250001

Muzaffarnagar, Uttar Pradesh-250001

2nd Address: A-45, Gagan Vihar, Rohtak Road, Mt. Plot No. 309, Gali No. 19, Block-D, Kamapur Tomar Colony, Burari Dili, Meerut, Uttar Pradesh-250002

Third Address: SME Development Centre, Plot No. C-11, G-Block, Bandra Kurla Complex, East Mumbai Suburban, Mumbai, Maharashtra-400051

Fourth Address: Kharsa No. 17, Opposite Crystal Park, Rohtak Road, Meerut, Uttar Pradesh-250002

Whereas the above named applicant has instituted a case against you and whereas it has been shown to the satisfaction of the Tribunal that it is not possible to serve you in ordinary way. Therefore, this notice is given by advertisement directing you to make appearance in this Tribunal

27-06-2022 at 10.30 A.M.

Take notice that in case of your failure to appear on the above mentioned day before this Tribunal, the case will be heard and decided in your absence.

Due to ongoing Pandemic situation, all the matters will be taken up through Video Conferencing and for that purpose:-

(i) All the Advocates/Litigants shall download the Cisco Webex application / software;

(ii) Meeting ID and Password for the next date of hearing qua cases to be taken by Registrar/Recovery Officer-I/and Recovery Officer-II shall be available one day prior to the next date at DRT Official Portal i.e. [drt.gov.in](http://drt.gov.in) under the Public Notice Head.

(iii) In any exigency qua that, the Advocates/Litigants can contact the concerned official at Ph. No. 23748469

Given under my hand and seal of this Tribunal on this the 11th day of May, 2022

By Order of the Tribunal

DRT-III, Delhi

PUBLIC NOTICE

HeroHousing Finance

We will be shifting our branch situated at

Hero Housing Finance Limited

Commercial Premise Office No 201, Second Floor, Saraswati Bhavan, Agashi Road, Virar West, Maharashtra- 401303

with effect from 27-Jun-2022 to

Hero Housing Finance Limited

Office no 501, 5 floor, M Baria Space, Tirupati Nagar, Phase -II Bolinj, Virar West, Taluka-Vasai, Dist- Palghar, Maharashtra- 401303

For any further details please contact:

customer.care@herohf.com, Toll Free Number: 18002128800

Hero Housing Finance Limited

CIN : U65192DL2016PLC301481

Regd Office: 9, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi-110057

For Advertising in TENDER PAGES Contact JITENDRA PATIL Mobile No.: 9029012015 Landline No.: 67440215

TATA MOTORS LIMITED

Registered Office: Bombay House, 24, Homi Moddy Street, Mumbai - 400 001.

Website: [www.tatamotors.com](http://www.tatamotors.com) E-mail: [inv\\_rel@tatamotors.com](mailto:inv_rel@tatamotors.com)

Corporate Identification No. (CIN) - L28920MH1945PLC004520

Notice

NOTICE IS HEREBY GIVEN pursuant to Section 91 of the Companies Act, 2013 read with Rule 10(1) of the Companies (Management and Administration) Rules, 2014 that Interest/Redemption proceeds on Non-Convertible Debentures issued on Private Placement basis &amp; listed on Wholesale Debt Market Segments of National Stock Exchange of India Limited and/or Bombay Stock Exchange Limited from July 1, 2022 to September 30, 2022 are given under:

ISIN of Security Due Date of payment Actual Date of payment Interest / Principal / Redemption Payment Record date

Non Convertible Debentures

INE155A08431 (E-30B Series) July 22, 2022 July 22, 2022 NCD Interest July 6, 2022

INE155A08191 (E-26B Series) August 20, 2022 August 20, 2022 NCD Interest August 4, 2022

INE155A08209 (E-26C Series) September 12, 2022 September 12, 2022 NCD Interest August 27, 2022

For Tata Motors Limited Sd/- Maloy Kumar Gupta Company Secretary

Mumbai June 21, 2022

TATA

IL&amp;FS WIND ENERGY LIMITED

Registered office: The IL&amp;FS Financial Centre, Plot C-22, G Block, Bandra-Kurla Complex Bandra (East), Mumbai - 400051

CIN: U40106MH2013PLC308845

Extract of Unaudited Financial Results for the quarter ended 30<sup>th</sup> September, 2021. (Rs. In Lakhs)Sr. No. Particulars Quarter ended 30.09.2021 Standalone Year to date figures for current period ended 30<sup>th</sup> September 2021 Previous Year ended 31.03.2021

Unaudited Unaudited Audited

1. Total Income from operations - - -

2. Net Profit for the period (before tax and exceptional items) 539.78 1,064.17 2134.33

3. Net Profit for the period before tax (after exceptional items) 539.78 1,064.17 2134.33

4. Net profit for the period after tax (after exceptional item) 402.85 794.90 1,548.35

5. Total Comprehensive income for the period 402.85 794.90 1,548.35

6. Equity Share Capital 49,005.00 49,005.00 49,005.00

7. Reserves (excluding revaluation reserve as shown in the Balance sheet) (70,533.62) (70,533.62) (71,328.52)

8. Earnings Per Share (a) Basic: 0.08 0.16 0.32 (b) Diluted: 0.07 0.14 0.27

9. Securities Premium Account - - -

10. Net Worth (21,528.62) (21,528.62) (22,323.52)

11. Paid Up Debt Capital 67,663.78 67,663.78 67,663.78

12. Outstanding Redeemable Preference Shares - - -

13. Debt Equity Ratio (3.14) (3.14) (3.03)

14. Capital Redemption Reserve - - -

15. Debenture Redemption Reserve - - -

16. Debt Service Coverage Ratio - - -

17. Interest Service coverage Ratio - - -

Notes: 1. The above is an extract of the detailed format of Unaudited Financial Results for the quarter ended September 30, 2021, filed with the stock exchange under SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of Financials Results for the Unaudited Financial Results for the quarter ended September 30, 2021, are available on the stock exchange website ([www.bseindia.com](http://www.bseindia.com)).

2. The statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 read with rule 3 of the Companies (Indian Accounting Standard) Rules, 2015 as amended.

For IL&amp;FS Wind Energy Limited Sd/- Feby Koshy Director

Place: Mumbai Date: June 20, 2022

UNIMONI FINANCIAL SERVICES LIMITED

RO: N.G. 12 &amp; 13 Ground Floor, North Block, Manipal Centre, Dickenson Road, Bangalore - 560 042. CIN No.U85110KA1995PLC018175

PUBLIC NOTICE

This is to inform the Public that Auction of pledged Gold Ornaments will be conducted by Unimoni Financial Services Limited on 24.06.2022 at 10:00 am at 101-105, FIRST FLOOR, EXPRESS CHAMBERS, ANDHERI-KURLA ROAD, MUMBAI - 400069. The Gold Ornaments to be auctioned belong to Loan Accounts of our various Customers who have failed to pay their dues. Our notices of auction have been duly issued to these borrowers. The Gold Ornaments to be auctioned belong to Overdue Loan Accounts of our various Customers mentioned below with branch name.

Loan Nos: MUMBAI - BORIVALI (MBB) -1890626. MUMBAI - FORT (MUF) -1884021, 1890580, 1890611, 1910397, 1887013, 1890928. MUMBAI - MALAD (MML) -1881112, 1880539. MUMBAI - MIRA ROAD (MUI) -1883302, 1905498.

For more details, please contact : Mr. NAVEEN SHETTY - 8291648221 (Reserves the right to alter the number of accounts to be auctioned &amp; / postpone / cancel the auction without any prior notice.)

@home NIKKAMAL LIMITED

CIN : L25209DN1985PLC000162

Regd. Office: Survey No. 354/2 &amp; 354/3, Near Rakholi Bridge, Silvassa-Khanvel Road, Vasona, Silvassa - 396 230 (Union Territory of Dadra &amp; Nagar Haveli)

Phone: 0260-2699212 • Fax: 0260-2699023

Email: investor@nikkamal.com • Website: [www.nikkamal.com](http://www.nikkamal.com)

CORRIGENDUM FOR NOTICE

36<sup>th</sup> ANNUAL GENERAL MEETING (AGM)

This refers to our earlier notice regarding 36th Annual General Meeting (AGM), which was published in the English newspaper "The Financial Express" and Gujarati Newspaper "Damanganga Times" dated 17th June, 2022. There is one amendment of date in the published notice in the paragraph no. 7 with regards to cut-off date for e-voting. Please read the said paragraph as below :

The remote e-voting period begins on Wednesday, July 13, 2022, (at 9:00 A.M.IST) and ends on Friday, July 15, 2022, (at 5:00 P.M. IST). During this period shareholders of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date Saturday, July 9, 2022, may cast their vote electronically. The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. The voting rights of Members shall be in proportion to their shares in the paid-up equity share capital of the Company as on the cut-off date i.e. July 9, 2022.

The rest of the contents will be the same. The said notice and its details are available on our company website [www.nikkamal.com](http://www.nikkamal.com).

By order of the Board of Directors Sd/- Priti Dave Company Secretary

Place : Mumbai Dated : 22-06-2022

Before Debts Recovery Tribunal-III, Delhi

4th Floor, Jeevan Tara Building, Parliament Street, New Delhi - 110001

Notice under section 19(4) of the Recovery of Debts Due to Banks and Financial Institutions Act, 1993 read with Rule 12 &amp; 13 of the Debts Recovery Tribunal (Procedure Rules) 1993

In the matter of O.A. No. 225/2021

STATE BANK OF INDIA Applicant

MRS. SUSHMA MALIK Vs

Defendants

To D-1. Mrs Sushma Malik W/o Mr. Pushpendra Malik Sole Proprietor of M/s Malik Generators R/o 17, Dunga Parasoli, District Muzaffarnagar, Uttar Pradesh-250001

Muzaffarnagar, Uttar Pradesh-250001

2nd Address: A-45, Gagan Vihar, Rohtak Road, Mt. Plot No. 309, Gali No. 19, Block-D, Kamapur Tomar Colony, Burari Dili, Meerut, Uttar Pradesh-250002

Third Address: SME Development Centre, Plot No. C-11, G-Block, Bandra Kurla Complex, East Mumbai Suburban, Mumbai, Maharashtra-400051

Fourth Address: Kharsa No. 17, Opposite Crystal Park, Rohtak Road, Meerut, Uttar Pradesh-250002

Whereas the above named applicant has instituted a case against you and whereas it has been shown to the satisfaction of the Tribunal that it is not possible to serve you in ordinary way. Therefore, this notice is given by advertisement directing you to make appearance in this Tribunal

27-06-2022 at 10.30 A.M.

Take notice that in case of your failure to appear on the above mentioned day before this Tribunal, the case will be heard and decided in your absence.

Due to ongoing Pandemic situation, all the matters will be taken up through Video Conferencing and for that purpose:-

(i) All the Advocates/Litigants shall download the Cisco Webex application / software;

(ii) Meeting ID and Password for the next date of hearing qua cases to be taken by Registrar/Recovery Officer-I/and Recovery Officer-II shall be available one day prior to the next date at DRT Official Portal i.e. [drt.gov.in](http://drt.gov.in) under the Public Notice Head.

(iii) In any exigency qua that, the Advocates/Litigants can contact the concerned official at Ph. No. 23748469

Given under my hand and seal of this Tribunal on this the 11th day of May, 2022

By Order of the Tribunal

DRT-III, Delhi

PUBLIC NOTICE

HeroHousing Finance

We will be shifting our branch situated at

Hero Housing Finance Limited

Commercial Premise Office No 201, Second Floor, Saraswati Bhavan, Agashi Road, Virar West, Maharashtra- 401303

with effect from 27-Jun-2022 to

Hero Housing Finance Limited

Office no 501, 5 floor, M Baria Space, Tirupati Nagar, Phase -II Bolinj, Virar West, Taluka-Vasai, Dist- Palghar, Maharashtra- 401303

For any further details please contact:

customer.care@herohf.com, Toll Free Number: 18002128800

Hero Housing Finance Limited

CIN : U65192DL2016PLC301481

Regd Office: 9, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi-110057

For Advertising in TENDER PAGES Contact JITENDRA PATIL Mobile No.: 9029012015 Landline No.: 67440215

TATA MOTORS LIMITED

Registered Office: Bombay House, 24, Homi Moddy Street, Mumbai - 400 001.

Website: [www.tatamotors.com](http://www.tatamotors.com) E-mail: [inv\\_rel@tatamotors.com](mailto:inv_rel@tatamotors.com)

Corporate Identification No. (CIN) - L28920MH1945PLC004520

Notice

NOTICE IS HEREBY GIVEN pursuant to Section 91 of the Companies Act, 2013 read with Rule 10(1) of the Companies (Management and Administration) Rules, 2014 that Interest/Redemption proceeds on Non-Convertible Debentures issued on Private Placement basis &amp; listed on Wholesale Debt Market Segments of National Stock Exchange of India Limited and/or Bombay Stock Exchange Limited from July 1, 2022 to September 30, 2022 are given under:

ISIN of Security Due Date of payment Actual Date of payment Interest / Principal / Redemption Payment Record date

Non Convertible Debentures

INE155A08431 (E-30B Series) July 22, 2022 July 22, 2022 NCD Interest July 6, 2022

INE155A08191 (E-26B Series) August 20, 2022 August 20, 2022 NCD Interest August 4, 2022

INE155A08209 (E-26C Series) September 12, 2022 September 12, 2022 NCD Interest August 27, 2022

For Tata Motors Limited Sd/- Maloy Kumar Gupta Company Secretary

Mumbai June 21, 2022

TATA

IL&amp;FS WIND ENERGY LIMITED

Registered office: The IL&amp;FS Financial Centre, Plot C-22, G Block, Bandra-Kurla Complex Bandra (East), Mumbai - 400051

CIN: U40106MH2013PLC308845

Extract of Unaudited Financial Results for the quarter ended 30<sup>th</sup> September, 2021. (Rs. In Lakhs)Sr. No. Particulars Quarter ended 30.09.2021 Standalone Year to date figures for current period ended 30<sup>th</sup> September 2021 Previous Year ended 31.03.2021

Unaudited Unaudited Audited

1. Total Income from operations - - -

2. Net Profit for the period (before tax and exceptional items) 539.78 1,064.17 2134.33

3. Net Profit for the period before tax (after exceptional items) 539.78 1,064.17 2134.33

4. Net profit for the period after tax (after exceptional item) 402.85 794.90 1,548.35

5. Total Comprehensive income for the period 402.85 794.90 1,548.35

6. Equity Share Capital 49,005.00 49,005.00 49,005.00

7. Reserves (excluding revaluation reserve as shown in the Balance sheet) (70,533.62) (70,533.62) (71,328.52)

8. Earnings Per Share (a) Basic: 0.08 0.16 0.32 (b) Diluted: 0.07 0.14 0.27

9. Securities Premium Account - - -

10. Net Worth (21,528.62) (21,528.62) (22,323.52)

11. Paid Up Debt Capital 67,663.78 67,663.78 67,663.78

12. Outstanding Redeemable Preference Shares - - -

13. Debt Equity Ratio (3.20) (3.20) (3.03)

14. Capital Redemption Reserve - - -

15. Debenture Redemption Reserve - - -

16. Debt Service Coverage Ratio - - -

17. Interest Service coverage Ratio - - -

Notes: 1. The above is an extract of the detailed format of Unaudited Financial Results for the quarter ended December 31, 2021, filed with the stock exchange under SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of Financials Results for the Unaudited Financial Results for the quarter ended December 31, 2021, are available on the stock exchange website ([www.bseindia.com](http://www.bseindia.com)).

2. The statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 read with rule 3 of the Companies (Indian Accounting Standard) Rules, 2015 as amended.

For IL&amp;FS Wind Energy Limited Sd/- Feby Koshy Director

Place: Mumbai Date: June 20, 2022

UNIMONI FINANCIAL SERVICES LIMITED

RO: N.G. 12 &amp; 13 Ground Floor, North Block, Manipal Centre, Dickenson Road, Bangalore - 560 042. CIN No.U85110KA1995PLC018175

PUBLIC NOTICE

This is to inform the Public that Auction of pledged Gold Ornaments will be conducted by Unimoni Financial Services Limited on 24.06.2022 at 10:00 am at 101-105, FIRST FLOOR, EXPRESS CHAMBERS, ANDHERI-KURLA ROAD, MUMBAI - 400069. The Gold Ornaments to be auctioned belong to Loan Accounts of our various Customers who have failed to pay their dues. Our notices of auction have been duly issued to these borrowers. The Gold Ornaments to be auctioned belong to Overdue Loan Accounts of our various Customers mentioned below with branch name.

Loan Nos: MUMBAI - BORIVALI (MBB) -1890626. MUMBAI - FORT (MUF) -1884021, 1890580, 1890611, 1910397, 1887013, 1890928. MUMBAI - MALAD (MML) -1881112, 1880539. MUMBAI - MIRA ROAD (MUI) -1883302, 1905498.

For more details, please contact : Mr. NAVEEN SHETTY - 8291648221 (Reserves the right to alter the number of accounts to be auctioned &amp; / postpone / cancel the auction without any prior notice.)

@home NIKKAMAL LIMITED

CIN : L25209DN1985PLC000162

Regd. Office: Survey No. 354/2 &amp; 354/3, Near Rakholi Bridge, Silvassa-Khanvel Road, Vasona, Silvassa - 396 230 (Union Territory of Dadra &amp; Nagar Haveli)

Phone: 0260-2699212 • Fax: 0260-2699023

Email: investor@nikkamal.com • Website: [www.nikkamal.com](http://www.nikkamal.com)

CORRIGENDUM FOR NOTICE

36<sup>th</sup> ANNUAL GENERAL MEETING (AGM)

This refers to our earlier notice regarding 36th Annual General Meeting (AGM), which was published in the English newspaper "The Financial Express" and Gujarati Newspaper "Damanganga Times" dated 17th June, 2022. There is one amendment of date in the published notice in the paragraph no. 7 with regards to cut-off date for e-voting. Please read the said paragraph as below :

The remote e-voting period begins on Wednesday, July 13, 2022, (at 9:00 A.M.IST) and ends on Friday, July 15, 2022, (at 5:00 P.M. IST). During this period shareholders of the Company, holding shares either in physical form or in dematerialized form, as on

Wednesday 22, June 2022


**છેલ્લા પાનાનુ યાલુ...**
**કાદવ-ફિડ્સ હટાવવા...**

નગરપાલિકા પ્રમુખ રાજુ મર્યાનો એ ખોદકામ કરીને ડ્રેનેજ લાઈન ઉપર પથ્થર કે અન્ય માટેરિયલ નાખવા માટે જણાવ્યું હતું તેમ છતાં નગર પાલિકા ધ્યાન નહીં આપતા પ્રથમ વર્ષ આવે જ વિસ્તારમાં કાદવ કીચ મોટા પ્રમાણમાં થતાં વિસ્તારના રહીશોમાં ભારે આકોશ જોવા મળ્યો હતો. વલસાડ પારડી વિસ્તારના થઈ હતી.

## ‘દમણગંગા ટાઈમ્સ’

**દૈનિક ઈન્ટરનેટ પર PDFમાં ઉપલબ્ધ છે.**

**@daman\_gangatimes**  
**www.damangangatimes.com**

<b>@home</b> <small>THE BEST HOME</small>	<b>નિલકમલ લિમિટેડ</b> <b>CIN<span> </span>: L25209DN1985PLC000162</b>	
<small>નોંધણીકૃત કાર્યાલય: સર્વે નં. 354/2 અને 354/3, રામોલી વિંચ નગરક, સિવસા - ખાનભેલ રોડ, વઘોળા, જિલ્લા - 396 230 (દાદરા અને નગર હવેલીનો કૅન્દ્ર વાસિત પ્રદેશ)</small>	<small>ફોન<span> </span>: 0260-2699212 • ફેક્સ<span> </span>: 0260-2699023</small>	<small>• ઇમેઇલ<span> </span>: investor@nikkamal.com • વેબસાઇટ<span> </span>: www.nikkamal.com</small>

**છત્રીસમી વાર્ષીક સાધારણ સભા (AGM)**

આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની છત્રીસમી વાર્ષિક સાધારણ સભા (એજ્યુએમ) શનિવાર, તા: ૧૬ જુલાઈ, ૨૦૨૨ ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે લિડિંગો કોન્ટ્રસ્ટ (વીસી) / અન્ય ઓફિસો લિઝન્સીઅલ માધ્યમે (એગ્રેવીએમ) દ્વારા કંપની કાયદા, ૨૦૧૩ ની જોગવાઈઓ, તે હેઠળ રચાયેલ નિયમો અને સેબી (લિસ્ટીંગ ઓબલીગેશન્સ અને ડિસ્ક્લોઝર રીકવલરમેન્ટ્સ) નિયમો, ૨૦૧૫ સહી બંધાતા કોપોરેટ બ્લાન્કની મંગાલવા (એમસીબી) પરિપત્ર તા: ૮ એપ્રિલ, ૨૦૨૦ અને તા: ૧૩ એપ્રિલ, ૨૦૨૦, તા: ૫ મે, ૨૦૨૦ તા: ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧ અને ૫ મે ૨૦૨૨ (સંયુક્ત રીતે એમસીબી પરિપત્રો તરીકે દર્શાવેલ છે) અને સિઝોનીટીઝ અને એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પરિપત્ર નં. SEBI/HO/CFD/CMD/1/CIR/P/૨૦૨૦/૩૯ તા: ૧૨ મે, ૨૦૨૦ અને SEBI/HO/CFD/CMD/3/CIR/P/૨૦૧૧/૧૧ તા: ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ (સેબી સરકયુલર તરીકે દર્શાવેલ) મુજબ એક જ સ્થળે સભ્યોની પ્રવચ્ચ ઉપસ્થિતિ વગર યોજાશે.

એમસીબી પરિપત્રો અને સેબી પરિપત્રો મુજબ કંપનીના વર્ષ ૨૦૨૧-૨૦૨૨ નો વાર્ષિક અહેવાલ તેમજ તા: ૩૧ માર્ચ, ૨૦૨૨ ના રોજ પુરા થતાં વર્ષના નાણાકીય નિવેદનો (વાર્ષિક અહેવાલ) / તેમજ એજ્યુએમની નોટીસ તથામ સભ્યો, જેમના એમેઇલ એડ્રેસ કંપની અધવા સંબંધિત ઈમેલોઈદરી પાર્ટીસીપન્ટસ (ઈપોઝીટરી) અને કંપનીના સ્ટ્રક્ચર અને ટ્રાન્સફર એજન્ટ, લિઝ્ક ઇન્ડાઇમ પ્રાઇવેટ લીમીટેડ સાથે સ્ટ્રક્ચર્ડ છે તેમને મંગલવાર, તા: ૨૧ જૂન, ૨૦૨૨ ના રોજ ફક્ત ઇમેઇલથી મોકલાયા છે. સભ્યો ફક્ત વીસી/એગ્રેવીએમ દ્વારા એમેઇલ દ્વારા જોડાયેલા છે અને ભાગ લઇ શકે છે. એજ્યુએમમાં જોડવા માટેની સુચનાઓ અને રીમોટ ઇલેક્ટ્રોનિક વોટીંગમાં ભાગ લેવાની અને એજ્યુએમ દરમિયાન ઇ-વોટીંગ સીસ્ટમના મત આપવાની રીત એજ્યુએમની નોટીસમાં આપેલ છે. વીસી/એગ્રેવીએમ અને ભાગ લેનાર સભ્યોની કંપની કાયદા, ૨૦૧૩ની કલમ ૧૦૩ હેઠળ કોરમની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવશે.

કંપનીનો વર્ષ ૨૦૨૧-૨૦૨૨ નો વાર્ષિક અહેવાલ તેમજ એજ્યુએમની નોટીસ કંપનીની વેબસાઇટ www.nikkamal.com અને બીસેઇટ અને નેશનલ સેકેડ એક્સચેન્જ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ www.bseindia.com અને www.nseindia.com ઉપલબ્ધ છે. ભૌતિક સ્વરૂપે શેરો ધરાવતા સભ્યો અને જેમણે તેમના ઇ-મેઇલ એડ્રેસ કંપનીમાં સુધરાવ્યા નથી તેઓ investor@nikkamal.com પર સભ્યોના સરનામાને સમર્થન આપતા સેફ્ટ દસ્તાવેજોની નકલ (ચો) કોલિયો નંબર, સભ્યનું નામ અને સરનામું જણાવતા સહી કરેલ વિનંતી પત્રની નકલ, (બી) નક કાર્ડની સ્વપ્ચાણીત નકલ અને (સી) કોઇપણ કોડ સ્વ પ્ચાણીત નકલ (દા.ત. આધાર, ડ્રાઇવિંગ લીસન્સ, ઇલેકશન એક્ટન્સીટી કાર્ડ, પાસપોર્ટ) પ્રમોટીંગ એજ્યુએમની નોટીસ, વાર્ષિક અહેવાલ અને/અથવા વીસી/એગ્રેવીએમ દ્વારા એજ્યુએમમાં જોડાવા અને ઇ-વોટીંગ માટેની લોગીન વિગતો મેળવી શકે છે.

વધુમા લોગીન વિગતો મેળવવા માટે સભ્ય(ઓ) ઉપરની વિગતો સીધી evoting@nsdl.co.in ઉપર મેઇલ કરી શકે છે.

બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે તેની સોમવાર, તા: ૨૩ મે, ૨૦૨૨ ના રોજ યોજાયેલ બેઠકમાં, તા: ૩૧ માર્ચ, ૨૦૨૨ ના રોજ પુરા થતાં નાણાકીય વર્ષ માટે ૧ ઓ ની ફેસ વધુ ધરાવતા ઇક્ષિટરી શેર દીઠ ૧૫ ના આપનરી ડિલિવન્ક ની ભલામણ કરી હતી.

આખરી ડિલિવન્ક ઇલેક્ટ્રોનિક ક્લીયરીંગ સર્વિસ (ઇસીએસ)/નેશનલ ઓટોમેટેડ ક્લીયરીંગ ઇક્સ (એનએસસીએચ) વગેરે દ્વારા સંબંધિત બેંક એક્ઝાઉટોમાં સીધા જમા કરવામાં આવશે. કોઇપણ લિંબલ વગર ડિલિવન્ક મેળવવા માટે, ભૌતિક સ્વરૂપે શેરો ધરાવતા સભ્યોને તેમની બેંક એકાઉન્ટ વિગતો સુધરાવવા માટે કોલિયો નંબર, તેમની બેંક એક્ઝાઉન્ટ ની વિગતો તેમજ સભ્યના નામનો ઓરીજનલ કન્સલ ચેક અને પેનની નકલ ધરાવતો સહી ફરેલ પત્ર મોકલે તે સંબંધમાં આહીતી કંપનીની વેબસાઇટ **www.nikkamal.com** પર પણ ઉપલબ્ધ છે.

કંપની આ બેંક વોલેટની નોટીસમાં જણાવેલ તમામ ઠરાવો પર ઇલેક્ટ્રોનિક રીતે મત આપવા માટે સભ્યોને રીમોટ ઇ-વોટીંગની સવલત આપતા આનંદ અનુભવે છે. ઇ-વોટીંગની સવલત એજ્યુએમમાં પણ ઉપલબ્ધ રહેશે અને વીસી/એગ્રેવીએમ દ્વારા એજ્યુએમમાં હાજર રહેનાર સભ્યો, જેમણે રીમોટ-ઇવોટીંગ થી તેમના મત આપ્યા નથી, તેઓ એજ્યુએમમાં મત આપવા માટે ફક્દાર ગણાશે. કમ્પાઇલી રીમોટ ઇ-વોટીંગ / એજ્યુએમ ખાતે ઇ-વોટીંગની સવલત પુરી પાડવા માટે એનએસસીડીની સેવાઓ લીધેલ છે.

રીમોટ ઇ-વોટીંગ ગાળો બુધવાર, તા: ૧૩ જુલાઈ, ૨૦૨૨ ના રોજ (સવારે ૯.૦૦ વાગ્યે) શરૂ થશે અને શુક્રવાર, તા: ૧૫ જુલાઈ, ૨૦૨૨ ના રોજ (સાંજે ૫.૦૦ વાગ્યે) પૂર્ણ થશે. આ ગાળા દરમિયાન ભૌતિક સ્વરૂપે અને ડિમરીરીયલઇઝડ સ્વરૂપે શેરો ધરાવતા કંપનીના શેરહોલ્ડરે કઠ ઓફ તારીખ શનિવાર, ૦૯ જુલાઇ, ૨૦૨૨ ના રોજ ઇલેક્ટ્રોનિક રીતે તેમના મત આપી શકે છે. ત્યારબાદ રીમોટ ઇ-વોટીંગ મોડ્યુલ એનએસસીડી દ્વારા બંધ કરવામાં આવશે. સભ્યોના મતદાન હકો કઠ ઓફ તારીખ એપ્રેલે કે તા: ૯ જુલાઇ, ૨૦૨૨ ના રોજ કંપનીની ભરપણ થયેલ ઇક્ષિટરી શેર મુદીમાં તેમના શેરોના ફિસાને અનુરૂપ રહેશે.

નોટીસ મોકલ્યા પછી કંપનીના શેરો મેળવનાર અને કંપનીની સભ્ય બનનાર અને કઠ ઓફ તારીખના દિવસે શેરો ધરાવતી કોઇપણ વ્યક્તિ evoting@nsdl.co.in ઉપર અરજી મોકલીને લોગીન આહીત અને પાસવર્ડ મેળવી શકે છે. આમ છતાં, જો તે/તેણી રીમોટ ઇ-વોટીંગ માટે પહેલેથી એનએસસીડીએલમાં રજીસ્ટર્ડ છે તો તે/તેણી તેના/તેણીના વર્તમાન યુઝર આહીટ અને પાસવર્ડનો મત આપવા માટે ઉપયોગ કરી શકે છે.

વીસી/એગ્રેવીએમ દ્વારા એજ્યુએમમાં જોડાવા અને રીમોટ ઇ-વોટીંગ /એજ્યુએમમાં ઇ-વોટીંગથી મત આપવા માટેની વિગતવાર સુચનાઓ એજ્યુએમની નોટીસમાં આપેલ છે. સભ્યોને કાળજીપૂર્વક તેને અનુસરવા વિનંતી છે. ઇ-વોટીંગ સવલત અને/અથવા વીસી/એગ્રેવીએમ સવલતના સંબંધમાં એજ્યુએમ પહેલા અથવા એજ્યુએમ દરમિયાન મદદ દે અથવા સભ્યો evoting@nsdl.co.in ઉપર અરજી મોકલી શકે છે અથવા ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૧૦૨૦૯૯૦/ ૧૮૦૦ ૨૨૪૪૩૦ નો ઉપયોગ કરી શકે છે.

જો પણ નોટીસ આપવામાં આવે છે કે કંપનીના સ્ટ્રક્ચર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક્સ શનિવાર, તા: ૯ જુલાઇ, ૨૦૨૨ થી શનિવાર, તા: ૬ જુલાઇ, ૨૦૨૨ સુધી (બંને દિવસો સહીત) વાર્ષિક સાધારણ સભા અને ડિલિવન્કના હેતુસર બંધ રહેશે.

કંપની, શુક્રવાર, તા: ૮ જુલાઇ, ૨૦૨૨ની રોજ ભૌતિક સ્વરૂપે અથવા ડિમરીરીયલઇઝડ સ્વરૂપે શેરો ધરાવનાર તમામ ઇક્ષિટરી શેરહોલ્ડરોને મંજૂર થયેલા ડિલિવન્ક યુકવાવા પાત્ર રહેશે.

**બોર્ડ ઓફ ડાયરેક્ટર વતી**

સહી/-  
**પ્રીતી પી. દવે**  
**(કંપની સેક્રેટરી)**

**પહેલા પાનાનુ યાલુ...**
**તિથલમાં પ્રથમવાર...**

ગુજરાતનાં પ્રથમ મહિલા ખ્યાતિ પટેલ કે જેમણે ૨૨૦ કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન ૪૮ કલાકમાં પૂર્ણ કરી છે, જેઓ વલસાડ બીચ મેરેથોનનાં બ્રાંડ એમ્બેસેડર બની વલસાડ બીચ મેરેથોન દ્વારા વલસાડનાં લોકોને દોડવાથી સ્વાસ્થ્ય સારું રહે છે નો મેસેજ આપશે, વલસાડનાં કલેક્ટર, વલસાડ વનવિભાગ, વલસાડ પોલીસ વિભાગ સન્ડે સ્પોર્ટ્સ ક્લબનાં વલસાડ બીચ મેરે થોનનાં કાર્યક્રમ થકી વલસાડ તીથલ બીચ તેમજ વલસાડ શહેર

**પહેલા પાનાનુ યાલુ...**
**વલસાડના ધારાસભ્ય...**

કચેરીએ ધસી જઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે દાંતી ગામે રેતીખાનની પ્રવૃત્તિના કારણે દાંતી ગામ દરિયામાં ગરક થવા નો ભય રહીશોને સતાવી રહ્યો છે. રેતી ખનન પ્રવૃત્તિના કારણે દાંતી ગામના સૌથી વધુ ઘરોમાં પાણી ઘુસી જવાના કારણે ભારે નુકસાની થઈ હતી. રાત્રી ગામના ગ્રામજનો ગુસ્સો જોઈ બીજા દિવસે વલસાડ ખનીજ વિભાગની ટીમ રેતી માફિયાઓને પકડવા દોડી ગઈ હતી. જોકે આ રેતી માફિયાઓએ કાંઠાના ગ્રામજનો અને ખનીજ વિભાગના અધિકારીઓનો ઊભી પૂંછડીએ

<b>@home</b> <small>THE BEST HOME</small>	<b>નિલકમલ લિમિટેડ</b> <b>CIN<span> </span>: L25209DN1985PLC000162</b>	
<small>નોંધણીકૃત કાર્યાલય: સર્વે નં. 354/2 અને 354/3, રામોલી વિંચ નગરક, સિવસા - ખાનભેલ રોડ, વઘોળા, જિલ્લા - 396 230 (દાદરા અને નગર હવેલીનો કૅન્દ્ર વાસિત પ્રદેશ)</small>	<small>ફોન<span> </span>: 0260-2699212 • ફેક્સ<span> </span>: 0260-2699023</small>	<small>• ઇમેઇલ<span> </span>: investor@nikkamal.com • વેબસાઇટ<span> </span>: www.nikkamal.com</small>

**સુધારો છત્રીસમી વાર્ષીક સાધારણ સભા (AGM) ની સૂચના**

આ ૩૬મી વાર્ષિક સામાન્ય સભા (AGM) સંબંધિત અમારી અગાઉની સૂચનાનો સંદર્ભ આપે છે, જે તા: ૧૭મી જૂન, ૨૦૨૨ના રોજ અંગ્રેજી અબધાર ‘ય ક્વહાન્સિયલ એક્સપ્રેસ’ અને ગુજરાતી અબધાર ‘દમણગંગા ટાઈમ્સ’માં પ્રકાશિત થઈ હતી. પ્રકાશિત નોટિસમાં તારીખનો એક સુધારો છે. ફક્કા નં. ૭, ઇ-વોટીંગ માટેની કટ-ઓફ તારીખના સંદર્ભમાં ક્યા કરીને નીચે મુજબનો ફક્કો વાંચો: રીમોટ ઇ-વોટીંગ ગાળો બુધવાર, તા: ૧૩ જુલાઇ, ૨૦૨૨ ના રોજ (સવારે ૯.૦૦ વાગ્યે) શરૂ થશે અને શુક્રવાર, તા: ૧૫ જુલાઇ, ૨૦૨૨ ના રોજ (સાંજે ૫.૦૦ વાગ્યે) પૂર્ણ થશે. આ ગાળા દરમિયાન ભૌતિક સ્વરૂપે અને ડિમરીરીયલઇઝડ સ્વરૂપે શેરો ધરાવતા કંપનીના શેરહોલ્ડરે કઠ ઓફ તારીખ શનિવાર, ૦૯ જુલાઇ, ૨૦૨૨ ના રોજ ઇલેક્ટ્રોનિક રીતે તેમના મત આપી શકે છે. ત્યારબાદ રીમોટ ઇ-વોટીંગ મોડ્યુલ એનએસસીડી દ્વારા બંધ કરવામાં આવશે. સભ્યોના મતદાન હકો કઠ ઓફ તારીખ એપ્રેલે કે તા: ૦૯ જુલાઇ, ૨૦૨૨ ના રોજ કંપનીની ભરપણ થયેલ ઇક્ષિટરી શેર મુદીમાં તેમના શેરોના ફિસાને અનુરૂપ રહેશે.

વાર્ષિક સામાન્ય સભાની વિગતોમાં ઉપર જણાવ્યા સિવાય અન્ય કોઇપણ ફેરફાર નથી. આ સૂચના અને તેની વિગતો કંપનીની વેબસાઇટ **www.nikkamal.com** પર ઉપલબ્ધ છે.

**બોર્ડ ઓફ ડાયરેક્ટર વતી**

સહી/-

**પ્રીતી પી. દવે**

**(કંપની સેક્રેટરી)**

## જાહેર નોટિસ

આથી લગતા વળગતા તમામને તથા જાહેર જનતાને જણાવવાનું કે **વલસાડ** ડિસ્ટ્રીક્ટની સબ ડિસ્ટ્રીક્ટ વાપી તાલુકાના મોજે **છીરી ખાતે આવેલ બીન ખેતીના સર્વે નં. ૧૪૨** વાળી જમીનમાં રહેઠાણને લાયક બાંધકામ કરવાના હેતુસર પાડવામાં આવેલ ઘોટો પૈકી **પ્લોટ નં. ૦૧ થી ૦૮** જેનું કુલ્લે **ત્રેસજી ૭૩૦૨.૨૯ ચો.મી.** છે, જેનો કોમ્પ્યુટરાઈઝડ સર્વે નં. ૧૪૨/પૈકી/પૈકી ૧ થી ૯વાળી જમીનમાં બાંધવામાં આવેલ આર.સી.સી. ટાઈપનું બિલ્ડીંગ જે “**સાઈ રેસીડન્સી**” ના નામે ઓળખાય છે, જેના “એ” બિલ્ડીંગના ત્રીજા માળે બાંધવામાં આવેલ રહેઠાણ લાયક ફલેટો પૈકી ફલેટ નં. એ-૦૭૯ જેનું **ત્રેસજી ૧૦૧૫.૦૦ ચો.ફુટ** થાને કે **૮૬.૩૩ ચો.મી. સુપર બિલ્ડઅપ એરીયા** છે. સદરહું ફલેટવાળી મિલકત હમારા અસીલ અન્સારી મુબારકકુસૈન અબ્દુલ હમીદને **તત્સનીઈ ઈમરાન શેખ** પાસેથી કાયદેસરનો અવેજ આપી ખરીદ કરી કબજે મેળવેલ છે. જે અંગેના રજી. વેચાણ દસ્તાવેજ મહે. વાપીના સબ રજીસ્ટ્રાર સાહેબની ક્વેરીમાં અનુક્રમ નં. ૧૦૭૨ ૧ થી તા. ૨૩/૦૮/૨૦૧૧ ના રોજ નોંધાયેલ છે. તથા **તત્સનીઈ ઈમરાન શેખ** અને અસારી મુબારકકુસૈન બાન તે સ્વ. મોહમદઉબેસ અબ્દુલકુદુસ પાનની પત્ની પાસેથી કાયદેસરનો અવેજ આપી ખરીદ કરી કબજે મેળવેલ છે. જે અંગેનો રજી. વેચાણ દસ્તાવેજ મહે. વાપીના સબ રજીસ્ટ્રાર સાહેબની ક્વેરીમાં અનુક્રમ નં. ૧૮૩૦ થી તા.૨૭/૦૫/૨૦૧૩ના રોજ નોંધાયેલ છે. **અન્સારી મુબારકકુસૈન અબ્દુલ હમીદ**નાઓના જણાવ્યા મુજબ મજકુર અનુક્રમ નં. **૫૫૦૪ થી તા.૩૧/૦૫/૨૦૧૩** ના રોજ નોંધાયેલ છે. તથા મોહમદઉબેસ અબ્દુલજલ્લ વેચાણ દસ્તાવેજ, રજીસ્ટ્રેશન ફી ની રસીડે ગેરવલ્લે થયેલ છે. તેમજ તેઓના જણાવ્યા મુજબ પૂબ જ શોધખોળ કરવા છતાં મળી આવેલ નથી. વધુમાં તેઓના જણાવ્યા મુજબ સદર દસ્તાવેજ તેઓએ કોઈ વ્યક્તિ, સંસ્થા કે બેંક કે અન્ય કોઈપણ નાણાં ધીરમત્ર સંસ્થાઓ પાસે ગીરવે મુકેલ નથી. તેમજ તેઓના જણાવ્યા મુજબ સદર મિલકત ઉપર તેઓએ કોઈપણ પ્રકારની લોન કે પિચાણ મેળવેલ નથી.

સદર મિલકત હમારા અસીલ વેચાણ કરવા માંગે છે. જે સંજોગોમાં સદર મિલકતમાં કોઈનો કોઈપણ પ્રકારનો ભાગ-ભાગ, હક્ક, હિત-હિસ્સો, અલાખો, અધિકાર, લીસપેન્સ, લીધન કે એટેચમેન્ટ, ઈજમન્ટ, મોરારી-પોપારી, જામીનગીરી, ચાજ-બોજો, દાવો-ફતીયાદ, ગીરો, બાનાખત, વિગેરે ચાલી આવેલ હોય તો આ જાહેર નોટીશ પ્રસિદ્ધ થયેથી દિન-૭ (સાત)માં એટ્ર મળી લેખિતમાં વાંધો વિરોધ નોંધાવવા. આ નોટીશમાં જણાવેલ મુજબ સદર દસ્તાવેજ વિત્યાબાદ કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો કે વિરોધ નથી તેમ માની અમારા અસીલ મુદત મિલકત વેચાણ કરી દેશે. અને ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો, વિરોધ, તર-તકરાર, દાવો, ફરિયાદ ચાલશે નહીં. જેની જાહેર જનતાએ તથા લાગતા વળગતાઓએ નોંધ લેવી.

તા. ૨૧/૦૬/૨૦૨૨

હમારા અસીલની સુચનાથી  
.....  
**ઑફિસ : ૫, ગ્રાઉન્ડ હોબર,**  
**હોટલ અમીરસની પાછળ, ગુંજન,**  
**જી.આઈ.ડી.સી., વાપી, તા.વાપી,**  
**જ. વલસાડ, મો. ૯૮૨૪૮ ૧૬૦૨૪**

**(ભાવિકા એચ. ભેસાણીયા)**

**એડવોકેટ**

થેલીમાં પથ્થર તથા માટી ભરી લાશને બાંધી દઈ પાણીમાં ડુબાડી દઈ તડપતી ભાગી છૂટ્યો હોવાની કબૂલાત કરતા વલસાડ રૂરલ પોલીસની ટીમે આરોપી મીતેશ તેને નીચે પાડી દે ફરીથી માથાના ભાગે પથ્થર મારી હત્યા કરી દીધી હતી. વિકાસની લાશનો નિકાલ કરવા માટે આરોપી પોતાના બાઈક પર ઘરે જઈ ઘરેથી પ્લાસ્ટિકની પટ્ટી અને કોથળો લઈ આવી પ્લાસ્ટિકની પટ્ટીથી મરણ જનાર વિકાસના બંને હાથ અને બંને પગ બાંધી થેલામાં નાખી ઘસળીને વાંકી નદી નજીક લાવી

નદી ગાડીરૂઢ બને તેવી સ્થિતિમાં પુર પ્રકોગ તે વાળવા પ્રતિવર્ષ ચોમાસાના આગોતરા આયોજન મુજબ ડેમના દરવાજા જૂન મહિનામાં ખોલવામાં આવતા હોય છે. તમામ દરવાજા ખોલી દેવાયા બાદ પણ ડેમ માં ૧.૪૫ એમસીએમ જેટલો શુદ્ધ પાણીનો જથ્થો સંગ્રહિત રહે છે. ડેમના દરવાજા ખોલતા માછીમારો ને તડકા પડ્યો હતો. ગણદેવી ડ્રેનેજ પેટા વિભાગના અધિકારી ખુશ્બુ પટેલ, આર એસ પંડ્યા અને પ્રતિક પટેલ એ કામગીરી પાર પાડી હતી.

માતાના મંદિર પાસેની પ્રાથમિક શાળામાં થઈ હતી. જ્યારે પાલિકા કક્ષાએ વલસાડમાં મ્યુનિસિપલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને નગર પાલિકાના પાર્કિંગ પ્લોટ, ધરમપુરમાં મહારાણા પ્રતાપ મેરેજ હોલ, પારડીમાં ધીરુભાઈ સત્સંગ હોલ, વાપીમાં રોકેલ કોલેજ અને ઉમરગામમાં બારીયા સમાજીના હોલમાં યોગ દિવસની ઉજવણી થઈ હતી.

વલસાડ તિથલ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર શિખા આગ્રે, જિલ્લા વિવેક અધિકારી મનિષ ગુરવાની, પ્રાયોજના વહીવટી બી.કે. વસાવા, નિવાસી અધિક કલેક્ટર એન.એ. રાજપૂત, વલસાડ અને ધરમપુરના પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા અને કે તુલ ઈટાલિયા, જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ. વસાવા, જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામીત, સિટી મામલતદાર કલ્પના ચૌધરી સહિત સર્વે અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

### CHANGE OF NAME

I HAVE CHANGED

MY OLD NAME

FROM JIFARBHAI

KACHLIYA TO NEW

NAME JIKKAR

KACHLIYA PLEASE

NOTE SD: JIKKAR

KACHLIYA

### CHANGE OF NAME

I HAVE CHANGED

MY OLD NAME

FROM

BHARATKUMAR

PATEL TO NEW

NAME BHARATBHAI

PATEL PLEASE

NOTE SD:

BHARATBHAI PATEL

**કે.ટી. ઈટાલિયા, (GAS) સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ધરમપુરની કોર્ટમાં,**  
**અરજદાર : સંગીતાબેન નયુભાઈ રાયઠ**  
**રહે. તામછડી, તા. ધરમપુર, જી.વલસાડ**  
**વિરુધ્ધ**  
**સામાવાળા : જન્મ-મરણ નોંધણી અધિકારીશ્રી અને**  
**તલાલી કમ મેનીસ્ટ્રી, તામછડી**  
**જન્મ-મરણ અધિનિયમ - ૧૯૬૯વા મુદત ૧૩ (૩) અનુચ્છે જન્મની નોંધ**  
**કરાવવા માટેનો હુકમ મેળવવા માટેની અરજી અનુચ્છે નોટીસ**  
આથી લાગતા વળગતા તમામને જણાવવાનું કે, અરજદારે જન્મ-મરણ અધિનિયમ હેઠલ અરજ છે કે, અરજદારશ્રી સંગીતાબેન નયુભાઈ રાયઠ, રહે. તામછડી તા. ધરમપુર જી.વલસાડનાઓએ તેમના પુત્રી નેન્સીબેન નયુભાઈ રાયડનો જન્મ તા.૧૫/૦૨/૨૦૧૬ના રોજ મોજે તામછડી તા. ધરમપુર મુકામે થયેલ છે તેમના જન્મની નોંધણી જે તે વખતે કાયદાથી અજાણ હોઈ પણ અને શરતનુકૂળી કરવાની રહી ગયેલ છે, જેથી અંગેની કોર્ટમાં અરજ દાખલ કરેલ છે. સદર જન્મની નોંધણી બાબતે કોર્ટેને વાંધો યા તકરાર હોય તો પોતે અથવા વકીલ